



**DEEP
Industries
Limited**

Oil & Gas Field Services

May 18, 2026

To,
Corporate Relations Department
BSE Limited
2nd Floor, P.J. Towers,
Dalal Street,
Mumbai-400001

To,
Corporate Relations Department
National Stock Exchange of India Limited
Exchange Plaza, Plot No. C-1, Block-G,
Bandra Kurla Complex, Bandra (East),
Mumbai - 400051

SCRIP CODE: 543288

SYMBOL: DEEPINDS

Sub: Regulation 47 of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015- Newspaper Publication of Financial Results

Dear Sir/Ma'am,

In compliance with Regulation 47 and other applicable provisions of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed herewith the copy of newspapers advertisement published on Saturday, May 16, 2026 in Business Standard (English) and Jai Hind (Gujarati) editions wherein the QR code for the audited standalone and consolidated Financial Results of the Company for the quarter and year ended on March 31, 2026 as approved by the Board of Directors of the Company have been published.

This intimation will also be uploaded on the Company's website at www.deepindustries.com.

You are requested to take the same on your record.

Thanking You,

Yours faithfully,

For, Deep Industries Limited

Shilpa Sharma
Company Secretary & Compliance Officer
M.No : A34516



Encl.: a/a



DEEP INDUSTRIES LIMITED
Regd.Off.: 12A & 14 Abhishree Corporate Park, Ambli - Bopal Road, Ambli, Ahmedabad-380058
Tel: +91 98256 00533, 99090 098998
Email: info@deepindustries.com | Website: www.deepindustries.com
CIN: L14292GJ2006PLC049371



NOTICE FOR DUPLICATE SHARE CERTIFICATE

This is to inform the general public that following share certificate(s) of Jindal Steel Ltd. (formerly known as Jindal Steel & Power Ltd.) having its registered office at O. P. Jindal Marg, Hisar, Haryana - 125 005, registered in the name of the following shareholders has been lost by them.

Sl. No.	Name of Holders	Certificate No(s)	Distinctive No(s)	No. of Shares	FV (Rs.)
5702	RAJIV KUMAR SANJIV KUMAR	51652 - 51655	226573 TO 226735	163	10

The public are hereby cautioned against purchasing or dealing in any way on the above referred share certificates.

Any person(s) who has a claim in respect of above mentioned Shares should lodge such claim(s) in writing supported by valid documents with Registrar & Transfer Agent, Alankrit Assignments Ltd., Alankit House, 4E/2, Jhandwan Extension, New Delhi - 110055, Tel.: 23541234, 42541234; Fax: 41543474 or Company within 15 days of publication of this notice. Thereafter no claims will be entertained and the RTA/Company will proceed to issuing duplicate share certificate(s) in lieu of original share certificate(s).

Date : Vadodra
Place : 15.05.2024

- RAJIV NARINDERNAH DAVESHWAR (formerly : Rajiv Kumar)

PUBLIC NOTICE

That, Residential Property bearing House Situated on City Survey No. 720 (Admeasuring about 83.613 Sq. Mtrs. As Per City Survey Record and Construction thereon Adm about 14.27 Sq. Mtrs. As Per Municipal Tax Bill) "Tajia Patel Ni Pole" of Mouje Kalapur - Ward - 2, Taluka - City, Dist. & Sub District: Ahmedabad was owned by Kalpanaben d/o. Kantilal Shah, Maheshbhai Kantilal Shah & Nileshbhai Kantilal Shah and said owners Kalpanaben d/o. Kantilal Shah, Maheshbhai Kantilal Shah & Nileshbhai Kantilal Shah became the joint owners of the said property & out of all the property documents Original Registration Receipt of Regd. Release Deed No. 2010 on dated 05-05-2017 and Original Registration Receipt of Regd. Release Deed No. 2138 on dated 17-05-2017 is lost, misplaced and not available and it is confirmed that they have not placed said original Title Document in any Bank, Financial Institution or any individual etc. to create third party lien, charge or hypothecation on the property mentioned above by way of Sale, Agreement, Mortgage, Hypothecation etc. Hence this Notice is published to invite claim, Share, Rights etc. of any Bank, Financial Company or any other individual etc. (if any) to raise their claim objection etc. in writing along with necessary proof therein within Seven (7) days of publication of this notice & on event of non receipt of any will issue Title Clearance Certificate which may please be noted& that, no claim will be entertained.

Date: 16-05-2024
Sd/- **Sadik Ghosura, Advocate**
Cont. No. 079-26405365. No. Under Bridge, Mithibai, Ahmedabad- 380002

Bank of Baroda

POSSESSION NOTICE (Sub-section 13 of the SARFAESI Act)

Whereas, The undersigned being the authorized officer of the Bank of Baroda under the Section 13 of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under Section 13(12) read with Section 13(13) of the Security Interest (Enforcement) Rules, 2002 issued Demand notice dated 13.01.2023 calling upon the borrower/guarantor to repay the amount of Rs. 15,53,327.47 (Rupees Fifteen Thousand Two Hundred Thirty Two And Paise Fifty Seven only) plus interest and other charges thereon within 60 days from the date of receipt of the said notice.

The borrower/guarantor having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of the said Act of 2002.

The borrower's attention is invited to provisions of section 13 (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

All that piece and parcel of immovable property bearing Plot No. 283 admeasuring 42.38 Sq. Mts. along with undivided proportionate share admeasuring 27.01 Sq. Mts. in common with the housing society known as "Shiv Vahika Village - 2", situated at Revenue Survey Nos. 70/1 & 70/2 of its Block No. 66 after re-survey Block No. 87 & 88 in Village: Nansal, Dist: Karmali, Dist. Surat. Boundaries East: Society Internal Road West: Adm. Road North: Shiv Vahika Village - 2, Plot No. 600. South: Shiv Vahika Village - 2, Plot No. 282.

Date: 14/05/2024 Place: Surat Authorized Officer: Bank of Baroda Nansal Branch/Surat

IDBI BANK LIMITED - SILVASSA BRANCH

Pin Code - 615011, Silvassa P.O. Silvassa, Union Territory of Silvassa.

POSSESSION NOTICE - (For Immovable Property)

Whereas, The undersigned being the authorized officer of IDBI Bank Limited under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of the powers conferred under Section 13(12) read with rule 3 of Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice Dated 03/04/2023 calling upon the borrower M/s. Ashwath Enterprises (Prop. M. Manish Mahesh) to repay the amount of Rs. 27,73,973.34 (Rupees Twenty Seven Lakh Seventy Three Thousand Nine Hundred Seventy Three and Paise Thirty Four only) as on February 01, 2023 and interest thereon within 60 days from the date of the receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the machinery described herein below, in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of the Act of 2002 read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this 11th day of May 2024.

The borrower's attention is invited to provisions of section 13 (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE MACHINERY

1. Jack Machine A28 - 4 Nos. 2. Jack Machine Jitsu 6 Noddle Kansal - 1 No. 3. SS 4 Thread O/L machine - 2 Nos. 4. Jaguar Cutting Machine 8 inch - 1 No. 5. End Cutter with Daisen Rib Machine - 1 No. 6. Press Table 16'24" - 1 No. 7. Pressing table with boiler - 1 No. 8. Jack Machine Flat Lock 1 HP Compressor - 1 No. 9. Jack A28 - 2CHZ. M/Complete Set Barak Machine - 1 No. 10. Kaj Machine - 1 No. 11. Button Sewing Machine - 1 No. 12. Side Mandar Machine - 1 No. 13. Epson Sewing Machine - 1 No. 14. Double Needle Sewing Machine - 1 No. 15. Bolser Machine - 1 No. 16. W4-D Flated Machine - 2 Nos. 17. 1404 - New Expert Kansal Machine - 2 Nos. 18. Singer Machine - 4 Nos. 19. Pegasus Sewing Machine - 2 Nos. 20. Side Machine - 2 Nos. 21. PUF Kaj Machine - 2 Nos. 22. 8 Needle Machine - 2 Nos. 23. Bolser Sewing Machine - 1 No. 24. W4-D Hasima Machine - 2 Nos. 25. 142 - New Special Subra Machine - 1 Nos.

Date: 11.05.2024, Place: Silvassa Sd/ Authorized Officer, IDBI Bank Ltd.

RBZ JEWELLERS LIMITED

Regd. Office: BLOCK-D, MONDIAL RETAIL PARK, NEAR RAJPATH CLUB, S.G. HIGHWAY, BESIDE ISCON MALL, AHMEDABAD, GUJARAT, INDIA, 380054. Tel: 079-999135740/41

Website: www.rbzjewellers.com. Email: cs@rbzjewellers.com, investor@rbzjewellers.com

EXTRACT OF ADDED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER YEAR ENDED 31st MARCH 2024

(₹ in Lakhs except share data)

Sl. No.	Particulars	Quarter Ended		Year Ended	
		31.03.2024	31.03.2023	31.03.2024	31.03.2023
1.	Total Income from Operations	18,949.36	22,633.02	13,729.20	63,646.02
2.	Net Profit/(Loss) for the period (Before Tax, Exceptional and/or Extraordinary Items)	1,825.91	2,338.35	1,140.80	5,250.93
3.	Net Profit/(Loss) for the period before tax (After Exceptional and/or Extraordinary Items)	1,605.91	2,338.35	1,140.80	7,383.88
4.	Net Profit/(Loss) for the period after tax (After Exceptional and/or Extraordinary Items)	1,167.96	1,743.01	856.91	5,478.91
5.	Total Comprehensive Income for the period (Comprising Profit/Loss for the period (after tax) and Other Comprehensive Income (after tax))	1,161.98	1,744.52	864.25	5,478.13
6.	Equity Share Capital	4,000	4,000	4,000	4,000
7.	Reserves as shown in the Audited Balance Sheet			25,962.31	20,504.18
8.	Earnings Per Share (EPS) on Face Value ₹ 100: each	2.92	4.36	2.14	13.70
9.	Dividend (%)	2.92	4.36	2.14	13.70

Notes: (1) The above financial results have been prepared in accordance with Indian Accounting Standards as prescribed under section 133 of the Companies Act 2013 read with Rule 3 of the Companies (Indian Accounting Standards) Rules, 2015 as amended from time to time. (2) The above is an extract of the detailed format of quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange websites at www.bseindia.com and www.nseindia.com and on the company's website www.rbzjewellers.com. The same can be accessed by scanning the QR code given below:

Place : Ahmedabad
Date : 14th May 2024

Bank of Baroda

POSSESSION NOTICE (Sub-section 13 of the SARFAESI Act)

Whereas, The undersigned being the authorized officer of the Bank of Baroda under the Section 13 of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under Section 13(12) read with Section 13(13) of the Security Interest (Enforcement) Rules, 2002 issued Demand notice dated 13.01.2023 calling upon the borrower/guarantor to repay the amount of Rs. 15,53,327.47 (Rupees Fifteen Thousand Two Hundred Thirty Two And Paise Fifty Seven only) plus interest and other charges thereon within 60 days from the date of receipt of the said notice.

The borrower/guarantor having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of the said Act of 2002.

The borrower's attention is invited to provisions of section 13 (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

All that piece and parcel of immovable property bearing Plot No. 283 admeasuring 42.38 Sq. Mts. along with undivided proportionate share admeasuring 27.01 Sq. Mts. in common with the housing society known as "Shiv Vahika Village - 2", situated at Revenue Survey Nos. 70/1 & 70/2 of its Block No. 66 after re-survey Block No. 87 & 88 in Village: Nansal, Dist: Karmali, Dist. Surat. Boundaries East: Society Internal Road West: Adm. Road North: Shiv Vahika Village - 2, Plot No. 600. South: Shiv Vahika Village - 2, Plot No. 282.

Date: 14/05/2024 Place: Surat Authorized Officer: Bank of Baroda Nansal Branch/Surat

sidbi

Asstt. Recovery Officer (Ahmedabad Unit)

Navvian Amrit Jayanti Bhavan, 1st Floor, Behind Gajdar Vihya Peeth, Navvian Rd., Ashram Road, Ahmedabad - 380014, Gujarat

Phone No. 079-27549904/079-27549924, Email Id: aravnit_ahmedabad@sidbi.in
Website: www.sidbi.in

SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES AND MOVABLE ASSETS

(See provision to Rule 8(1) & Rule 6(2))

E-Auction Sale Notice for Sale of Immovable properties and Movable Assets under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8(1) and Rule 6(2) of the Security Interest (Enforcement) Rules, 2002.

Whereas, the undersigned being the authorized officer of the Bank of Baroda and the Guarantors that the below described Immovable Properties and Movable Assets (Machinery) Hypothecated / Charged to Small Industries Development Bank of India (SIDBI) / the Secured Creditor, the Physical Possession of which has been taken by the undersigned officer of SIDBI, the Secured Creditor from M/s. Sunshine Fastech Ltd. (Earlier Sunshine Fastech Pvt. Ltd.) (Borrower) and its Guarantors/Mortgages as named in the notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the machinery described herein below, in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of the Act of 2002 read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this 11th day of May 2024.

The borrower's attention is invited to provisions of section 13 (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE MACHINERY

1. Jack Machine A28 - 4 Nos. 2. Jack Machine Jitsu 6 Noddle Kansal - 1 No. 3. SS 4 Thread O/L machine - 2 Nos. 4. Jaguar Cutting Machine 8 inch - 1 No. 5. End Cutter with Daisen Rib Machine - 1 No. 6. Press Table 16'24" - 1 No. 7. Pressing table with boiler - 1 No. 8. Jack Machine Flat Lock 1 HP Compressor - 1 No. 9. Jack A28 - 2CHZ. M/Complete Set Barak Machine - 1 No. 10. Kaj Machine - 1 No. 11. Button Sewing Machine - 1 No. 12. Side Mandar Machine - 1 No. 13. Epson Sewing Machine - 1 No. 14. Double Needle Sewing Machine - 1 No. 15. Bolser Machine - 1 No. 16. W4-D Flated Machine - 2 Nos. 17. 1404 - New Expert Kansal Machine - 2 Nos. 18. Singer Machine - 4 Nos. 19. Pegasus Sewing Machine - 2 Nos. 20. Side Machine - 2 Nos. 21. PUF Kaj Machine - 2 Nos. 22. 8 Needle Machine - 2 Nos. 23. Bolser Sewing Machine - 1 No. 24. W4-D Hasima Machine - 2 Nos. 25. 142 - New Special Subra Machine - 1 Nos.

Date: 11.05.2024, Place: Silvassa Sd/ Authorized Officer, IDBI Bank Ltd.

DEEP INDUSTRIES LIMITED

CIN: L14292GJ2009PLC049371

Registered Address: 12A & 14, Abhishekh Corporate Park, Ambli Bopal Road, Ambli, Ahmedabad - 380 058. Ph: +91 98256 00533, +91 9990 09898. E-mail: cs@deepindustries.com. Website: www.deepindustries.com

EXTRACTS OF ADDED STANDALONE & CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON 31st MARCH, 2024

The Full format of the financial results for the quarter and year ended 31st March 2024 are available on the Stock Exchange website (www.bseindia.com and www.nseindia.com) and on the Company's website (www.deepindustries.com). The same can be accessed by scanning the QR code provided below.

Place : Ahmedabad
Date : 16.05.2024

Bank of Baroda

POSSESSION NOTICE (Sub-section 13 of the SARFAESI Act)

Whereas, The undersigned being the authorized officer of the Bank of Baroda under the Section 13 of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under Section 13(12) read with Section 13(13) of the Security Interest (Enforcement) Rules, 2002 issued Demand notice dated 13.01.2023 calling upon the borrower/guarantor to repay the amount of Rs. 15,53,327.47 (Rupees Fifteen Thousand Two Hundred Thirty Two And Paise Fifty Seven only) plus interest and other charges thereon within 60 days from the date of receipt of the said notice.

The borrower/guarantor having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of the said Act of 2002.

The borrower's attention is invited to provisions of section 13 (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

All that piece and parcel of immovable property bearing Plot No. 600, as per site admeasuring area 72.00 sq. yard i.e. 60.20 sq.mts. (as per Plan admeasuring 55.93 sq.mts) with construction, along with undivided proportionate share admeasuring 31.22 sq. mtrs. in Village: Adm. Road in the said residency which is known as "Shiv Vahika Village - 2", situated at Revenue Survey Nos. 70/1 & 70/2 of its Block No. 66 after re-survey Block No. 87 & 88 in Village: Nansal, Dist: Karmali, Dist. Surat. Boundaries East: Society Internal Road West: Adm. Road North: Shiv Vahika Village - 2, Plot No. 600. South: Shiv Vahika Village - 2, Plot No. 282.

In the Document you have acknowledged your liability to the Bank to the tune of Rs.15.50 Lacs as on 31.03.2023 & other bank charges as per bank guidelines. As you are aware, you have committed default in payment of the above loan facility as per the terms of the loan agreement dated 10.04.2022. In view of the above, you are hereby notified that the Bank has taken possession of the property described herein above in exercise of powers conferred on it by the SARFAESI Act, 2002 and the Security Interest (Enforcement) Rules, 2002. You are hereby notified that the Bank has taken possession of the property described herein above in exercise of powers conferred on it by the SARFAESI Act, 2002 and the Security Interest (Enforcement) Rules, 2002. You are hereby notified that the Bank has taken possession of the property described herein above in exercise of powers conferred on it by the SARFAESI Act, 2002 and the Security Interest (Enforcement) Rules, 2002. You are hereby notified that the Bank has taken possession of the property described herein above in exercise of powers conferred on it by the SARFAESI Act, 2002 and the Security Interest (Enforcement) Rules, 2002.

The borrower's attention is invited to provisions of section 13 (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

All that piece and parcel of immovable property bearing Plot No. 600, as per site admeasuring area 72.00 sq. yard i.e. 60.20 sq.mts. (as per Plan admeasuring 55.93 sq.mts) with construction, along with undivided proportionate share admeasuring 31.22 sq. mtrs. in Village: Adm. Road in the said residency which is known as "Shiv Vahika Village - 2", situated at Revenue Survey Nos. 70/1 & 70/2 of its Block No. 66 after re-survey Block No. 87 & 88 in Village: Nansal, Dist: Karmali, Dist. Surat. Boundaries East: Society Internal Road West: Adm. Road North: Shiv Vahika Village - 2, Plot No. 600. South: Shiv Vahika Village - 2, Plot No. 282.

In the Document you have acknowledged your liability to the Bank to the tune of Rs.15.50 Lacs as on 31.03.2023 & other bank charges as per bank guidelines. As you are aware, you have committed default in payment of the above loan facility as per the terms of the loan agreement dated 10.04.2022. In view of the above, you are hereby notified that the Bank has taken possession of the property described herein above in exercise of powers conferred on it by the SARFAESI Act, 2002 and the Security Interest (Enforcement) Rules, 2002. You are hereby notified that the Bank has taken possession of the property described herein above in exercise of powers conferred on it by the SARFAESI Act, 2002 and the Security Interest (Enforcement) Rules, 2002. You are hereby notified that the Bank has taken possession of the property described herein above in exercise of powers conferred on it by the SARFAESI Act, 2002 and the Security Interest (Enforcement) Rules, 2002. You are hereby notified that the Bank has taken possession of the property described herein above in exercise of powers conferred on it by the SARFAESI Act, 2002 and the Security Interest (Enforcement) Rules, 2002.

The borrower's attention is invited to provisions of section 13 (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

All that piece and parcel of immovable property bearing Plot No. 600, as per site admeasuring area 72.00 sq. yard i.e. 60.20 sq.mts. (as per Plan admeasuring 55.93 sq.mts) with construction, along with undivided proportionate share admeasuring 31.22 sq. mtrs. in Village: Adm. Road in the said residency which is known as "Shiv Vahika Village - 2", situated at Revenue Survey Nos. 70/1 & 70/2 of its Block No. 66 after re-survey Block No. 87 & 88 in Village: Nansal, Dist: Karmali, Dist. Surat. Boundaries East: Society Internal Road West: Adm. Road North: Shiv Vahika Village - 2, Plot No. 600. South: Shiv Vahika Village - 2, Plot No. 282.

In the Document you have acknowledged your liability to the Bank to the tune of Rs.15.50 Lacs as on 31.03.2023 & other bank charges as per bank guidelines. As you are aware, you have committed default in payment of the above loan facility as per the terms of the loan agreement dated 10.04.2022. In view of the above, you are hereby notified that the Bank has taken possession of the property described herein above in exercise of powers conferred on it by the SARFAESI Act, 2002 and the Security Interest (Enforcement) Rules, 2002. You are hereby notified that the Bank has taken possession of the property described herein above in exercise of powers conferred on it by the SARFAESI Act, 2002 and the Security Interest (Enforcement) Rules, 2002. You are hereby notified that the Bank has taken possession of the property described herein above in exercise of powers conferred on it by the SARFAESI Act, 2002 and the Security Interest (Enforcement) Rules, 2002. You are hereby notified that the Bank has taken possession of the property described herein above in exercise of powers conferred on it by the SARFAESI Act, 2002 and the Security Interest (Enforcement) Rules, 2002.

The borrower's attention is invited to provisions of section 13 (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

All that piece and parcel of immovable property bearing Plot No. 600, as per site admeasuring area 72.00 sq. yard i.e. 60.20 sq.mts. (as per Plan admeasuring 55.93 sq.mts) with construction, along with undivided proportionate share admeasuring 31.22 sq. mtrs. in Village: Adm. Road in the said residency which is known as "Shiv Vahika Village - 2", situated at Revenue Survey Nos. 70/1 & 70/2 of its Block No. 66 after re-survey Block No. 87 & 88 in Village: Nansal, Dist: Karmali, Dist. Surat. Boundaries East: Society Internal Road West: Adm. Road North: Shiv Vahika Village - 2, Plot No. 600. South: Shiv Vahika Village - 2, Plot No. 282.

In the Document you have acknowledged your liability to the Bank to the tune of Rs.15.50 Lacs as on 31.03.2023 & other bank charges as per bank guidelines. As you are aware, you have committed default in payment of the above loan facility as per the terms of the loan agreement dated 10.04.2022. In view of the above, you are hereby notified that the Bank has taken possession of the property described herein above in exercise of powers conferred on it by the SARFAESI Act, 2002 and the Security Interest (Enforcement) Rules, 2002. You are hereby notified that the Bank has taken possession of the property described herein above in exercise of powers conferred on it by the SARFAESI Act, 2002 and the Security Interest (Enforcement) Rules, 2002. You are hereby notified that the Bank has taken possession of the property described herein above in exercise of powers conferred on it by the SARFAESI Act, 2002 and the Security Interest (Enforcement) Rules, 2002. You are hereby notified that the Bank has taken possession of the property described herein above in exercise of powers conferred on it by the SARFAESI Act, 2002 and the Security Interest (Enforcement) Rules, 2002.

The borrower's attention is invited to provisions of section 13 (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

All that piece and parcel of immovable property bearing Plot No. 600, as per site admeasuring area 72.00 sq. yard i.e. 60.20 sq.mts. (as per Plan admeasuring 55.93 sq.mts) with construction, along with undivided proportionate share admeasuring 31.22 sq. mtrs. in Village: Adm. Road in the said residency which is known as "Shiv Vahika Village - 2", situated at Revenue Survey Nos. 70/1 & 70/2 of its Block No. 66 after re-survey Block No. 87 & 88 in Village: Nansal, Dist: Karmali, Dist. Surat. Boundaries East: Society Internal Road West: Adm. Road North: Shiv Vahika Village - 2, Plot No. 600. South: Shiv Vahika Village - 2, Plot No. 282.

In the Document you have acknowledged your liability to the Bank to the tune of Rs.15.50 Lacs as on 31.03.2023 & other bank charges as per bank guidelines. As you are aware, you have committed default in payment of the above loan facility as per the terms of the loan agreement dated 10.04.2022. In view of the above, you are hereby notified that the Bank has taken possession of the property described herein above in exercise of powers conferred on it by the SARFAESI Act, 2002 and the Security Interest (Enforcement) Rules, 2002. You are hereby notified that the Bank has taken possession of the property described herein above in exercise of powers conferred on it by the SARFAESI Act, 2002 and the Security Interest (Enforcement) Rules, 2002. You are hereby notified that the Bank has taken possession of the property described herein above in exercise of powers conferred on it by the SARFAESI Act, 2002 and the Security Interest (Enforcement) Rules, 2002. You are hereby notified that the Bank has taken possession of the property described herein above in exercise of powers conferred on it by the SARFAESI Act, 2002 and the Security Interest (Enforcement) Rules, 2002.

The borrower's attention is invited to provisions of section 13 (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

All that piece and parcel of immovable property bearing Plot No. 600, as per site admeasuring area 72.00 sq. yard i.e. 60.20 sq.mts. (as per Plan admeasuring 55.93 sq.mts) with construction, along with undivided proportionate share admeasuring 31.22 sq. mtrs. in Village: Adm. Road in the said residency which is known as "Shiv Vahika Village - 2", situated at Revenue Survey Nos. 70/1 & 70/2 of its Block No. 66 after re-survey Block No. 87 & 88 in Village: Nansal, Dist: Karmali, Dist. Surat. Boundaries East: Society Internal Road West: Adm. Road North: Shiv Vahika Village - 2, Plot No. 600. South: Shiv Vahika Village - 2, Plot No. 282.

In the Document you have acknowledged your liability to the Bank to the tune of Rs.15.50 Lacs as on 31.03.2023 & other bank charges as per bank guidelines. As you are aware, you have committed default in payment of the above loan facility as per the terms of the loan agreement dated 10.04.2022. In view of the above, you are hereby notified that the Bank has taken possession of the property described herein above in exercise of powers conferred on it by the SARFAESI Act, 2002 and the Security Interest (Enforcement) Rules, 2002. You are hereby notified that the Bank has taken possession of the property described herein above in exercise of powers conferred on it by the SARFAESI Act, 2002 and the Security Interest (Enforcement) Rules, 2002. You are hereby notified that the Bank has taken possession of the property described herein above in exercise of powers conferred on it by the SARFAESI Act, 2002 and the Security Interest (Enforcement) Rules, 2002. You are hereby notified that the Bank has taken possession of the property described herein above in exercise of powers conferred on it by the SARFAESI Act, 2002 and the Security Interest (Enforcement) Rules, 2002.

The borrower's attention is invited to provisions of section 13 (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

All that piece and parcel of immovable property bearing Plot No. 600, as per site admeasuring area 72.00 sq. yard i.e. 60.20 sq.mts. (as per Plan admeasuring 55.93 sq.mts) with construction, along with undivided proportionate share admeasuring 31.22 sq. mtrs. in Village: Adm. Road in the said residency which is known as "Shiv Vahika Village - 2", situated at Revenue Survey Nos. 70/1 & 70/2 of its Block No. 66 after re-survey Block No. 87 & 88 in Village: Nansal, Dist: Karmali, Dist. Surat. Boundaries East: Society Internal Road West: Adm. Road North: Shiv Vahika Village - 2, Plot No. 600. South: Shiv Vahika Village - 2, Plot No. 282.

In the Document you have acknowledged your liability to the Bank to the tune of Rs.15.50 Lacs as on 31.03.2023 & other bank charges as per bank guidelines. As you are aware, you have committed default in payment of the above loan facility as per the terms of the loan agreement dated 10.04.2022. In view of the above, you are hereby notified that the Bank has taken possession of the property described herein above in exercise of powers conferred on it by the SARFAESI Act, 2002 and the Security Interest (Enforcement) Rules, 2002. You are hereby notified that the Bank has taken possession of the property described herein above in exercise of powers conferred on it by the SARFAESI Act, 2002 and the Security Interest (Enforcement) Rules, 2002. You are hereby notified that the Bank has taken possession of the property described herein above in exercise of powers conferred on it by the SARFAESI Act, 2002 and the Security Interest (Enforcement) Rules, 2002. You are hereby notified that the Bank has taken possession of the property described herein above in exercise of powers conferred on it by the SARFAESI Act, 2002 and the Security Interest (Enforcement) Rules, 2002.

The borrower's attention is invited to provisions of section 13 (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

All that piece and parcel of immovable property bearing Plot No. 600, as per site admeasuring area 72.00 sq. yard i.e. 60.20 sq.mts. (as per Plan admeasuring 55.93 sq.mts) with construction, along with undivided proportionate share admeasuring 31.22 sq. mtrs. in Village: Adm. Road in the said residency which is known as "Shiv Vahika Village - 2", situated at Revenue Survey Nos. 70/1 & 70/2 of its Block No. 66 after re-survey Block No. 87 & 88 in Village: Nansal, Dist: Karmali, Dist. Surat. Boundaries East: Society Internal Road West: Adm. Road North: Shiv Vahika Village - 2, Plot No. 600. South: Shiv Vahika Village - 2, Plot No. 282.

In the Document you have acknowledged your liability to the Bank to the tune of Rs.15.50 Lacs as on 31.03.2023 & other bank charges as per bank guidelines. As you are aware, you have committed default in payment of the above loan facility as per the terms of the loan agreement dated 10.04.2022. In view of the above, you are hereby notified that the Bank has taken possession of the property described herein above in exercise of powers conferred on it by the SARFAESI Act, 2002 and the Security Interest (Enforcement) Rules, 2002. You are hereby notified that the Bank has taken possession of the property described herein above in exercise of powers conferred on it by the SARFAESI Act, 2002 and the Security Interest (Enforcement) Rules, 2002. You are hereby notified that the Bank has taken possession of the property described herein above in exercise of powers conferred on it by the SARFAESI Act, 2002 and the Security Interest (Enforcement) Rules, 2002. You are hereby notified that the Bank has taken possession of the property described herein above in exercise of powers conferred on it by the SARFAESI Act, 2002 and the Security Interest (Enforcement) Rules, 2002.

The borrower's attention is invited to provisions of section 13 (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

All that piece and parcel of immovable property bearing Plot No. 600, as per site admeasuring area 72.00 sq. yard i.e. 60.20 sq.mts. (as per Plan admeasuring 55.93 sq.mts) with construction, along with undivided proportionate share admeasuring 31.22 sq. mtrs. in Village: Adm. Road in the said residency which is known as "Shiv Vahika Village - 2", situated at Revenue Survey Nos. 70/1 & 70/2 of its Block No. 66 after re-survey Block No. 87 & 88 in Village: Nansal, Dist: Karmali, Dist. Surat. Boundaries East: Society Internal Road West: Adm. Road North: Shiv Vahika Village - 2, Plot No. 600. South: Shiv Vahika Village - 2, Plot No. 282.

In the Document you have acknowledged your liability to the Bank to the tune of Rs.15.50 Lacs as on 31.03.2023 & other bank charges as per bank guidelines. As you are aware, you have committed default in payment of the above loan facility as per the terms of the loan agreement dated 10.04.2022. In view of the above, you are hereby notified that the Bank has taken possession of the property described herein above in exercise of powers conferred on it by the SARFAESI Act, 2002 and the Security Interest (Enforcement) Rules, 2002. You are hereby notified that the Bank has taken possession of the property described herein above in exercise of powers conferred on it by the SARFAESI Act, 2002 and the Security Interest (Enforcement) Rules, 2002. You are hereby notified that the Bank has taken possession of the property described herein above in exercise of powers conferred on it by the SARFAESI Act, 2002 and the Security Interest (Enforcement) Rules, 2002. You are hereby notified that the Bank has taken possession of the property described herein above in exercise of powers conferred on it by the SARFAESI Act, 2002 and the Security Interest (Enforcement) Rules, 2002.

The borrower's attention is invited to provisions of section 13 (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

All that piece and parcel of immovable property bearing Plot No. 600, as per site admeasuring area 72.00 sq. yard i.e. 60.20 sq.mts. (as per Plan admeasuring 55.93 sq.mts) with construction, along with undivided proportionate share admeasuring 31.22 sq. mtrs. in Village: Adm. Road in the said residency which is known as "Shiv Vahika Village - 2", situated at Revenue Survey Nos. 70/1 & 70/2 of its Block No. 66 after re-survey Block No. 87 & 88 in Village: Nansal, Dist: Karmali, Dist. Surat. Boundaries East: Society Internal Road West: Adm. Road North: Shiv Vahika Village - 2, Plot No. 600. South: Shiv Vahika Village - 2, Plot No. 282.

In the Document you have acknowledged your liability to the Bank to the tune of Rs.15.50 Lacs as on 31.03.2023 & other bank charges as per bank guidelines. As you are aware, you have committed default in payment of the above loan facility as per the terms of the loan agreement dated 10.04.2022. In view of the above, you are hereby notified that the Bank has taken possession of the property described herein above in exercise of powers conferred on it by the SARFAESI Act, 2002 and the Security Interest (Enforcement) Rules, 2002. You are hereby notified that the Bank has taken possession of the property described herein above in exercise of powers conferred on it by the SARFAESI Act, 2002 and the Security Interest (Enforcement) Rules, 2002. You are hereby notified that the Bank has taken possession of the property described herein above in exercise of powers conferred on it by the SARFAESI Act, 2002 and the Security Interest (Enforcement) Rules, 2002. You are hereby notified that the Bank has taken possession of the property described herein above in exercise of powers conferred on it by the SARFAESI Act, 2002 and the Security Interest (Enforcement) Rules, 2002.

The borrower's attention is invited to provisions of section 13 (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

All that piece and parcel of immovable property bearing Plot No. 600, as per site admeasuring area 72.00 sq. yard i.e. 60.20 sq.mts. (as per Plan admeasuring 55.93 sq.mts) with construction, along with undivided proportionate share admeasuring 31.22 sq. mtrs. in Village: Adm. Road in the said residency which is known as "Shiv Vahika Village - 2", situated at Revenue Survey Nos. 70/1 & 70/2 of its Block No. 66 after re-survey Block No. 87 & 88 in Village: Nansal, Dist: Karmali, Dist. Surat. Boundaries East: Society Internal Road West: Adm. Road North: Shiv Vahika Village - 2, Plot No. 600. South: Shiv Vahika Village - 2, Plot No. 282.

In the Document you have acknowledged your liability to the Bank to the tune of Rs.15.50 Lacs as on 31.03.2023 & other bank charges as per bank guidelines. As you are aware, you have committed default in payment of the above loan facility as per the terms of the loan agreement dated 10.04.2022. In view

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિમાં સ્થાન ધરાવતા ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સામે કેસ બંધ થયો

અમેરિકી ફોડમાં સમાધાન કરવા ૧૮ મીલીયન ડોલર ચુકવવા અદાણી ગ્રુપ તૈયાર

નવી દિલ્હી, તા.૧૫
દેશના ટોચના ઉદ્યોગ ગુહ અદાણી સામે અમેરિકામાં સિક્યુરીટી એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા જે લાંબાનો કેસ કરાયો છે તેમાં ગ્રુપના વડા ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર

આવશે અને તે આ સેટેલિટ્સ થઈ બંધ થશે અને આ ગ્રુપ ફરી એક વખત આંતરરાષ્ટ્રીય નાણાકીય બજારમાં પોતાના ભવિષ્યના આયોજન માટે ભંડોળ ઉઘરાવી શકશે. આ સેટેલિટ્સ હેઠળ ગૌતમ અદાણી ૬૦ લાખ ડોલર અને તેના ભત્રીજા સાગર અદાણી ૧.૨૦ કરોડ ડોલરની ચુકવણી કરશે. ગઈકાલે આ અંગેનો એક કરાર ન્યુયોર્કની ફેડરલ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે. અગાઉ ૭ રીપોર્ટ આવી ગયા હતા કે અમેરિકાનો ન્યાય વિભાગ ગૌતમ અદાણી અને તેના ભત્રીજા સામે ફોડનો જે કેસ છે તે બંધ કરવા જઈ રહી છે. દેશના કોઈ ટોચના ઉદ્યોગપતિ સામે આ પ્રકારે ફોડના સૌથી ગંભીર અપરાધ અદાણી ગ્રુપ સામે ચુકવવામાં આવ્યા હતા અને તેમાં તેમની સામે વોરંટ પણ કાઢવામાં આવ્યું હતું પરંતુ ભારત સરકારે આ વોરંટની બંધવણી કરી ન હતી તથા અદાણી ગ્રુપને સેટેલિટ્સ કરવા સમય મળે તે નિશ્ચિત કર્યું હતું. અમેરિકાના સિક્યુરીટી એન્ડ એક્સચેન્જ કમિશનનો આરોપ હતો કે ગૌતમ અદાણીએ અમેરિકામાં ફંડ સહી કરવા માટે કરોડો ડોલરની લાંબ આપવાની ઓફર કરી હતી જેના કારણે અદાણી ગ્રુપને ભારતમાં દેશના સૌથી મોટા સોલાર પાવર પ્લાન્ટ બનાવવાની પ્રક્રિયા સરળ થઈ શકે તેમ હતી.



શહેરમાં ટીઆરબી પાર્કિંગ આઉટ પરેડનું આયોજન કરાયું હતું તેમાં પોલીસ કમિશ્નર જી.એસ. મલિક ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યમાં ગરમીના પ્રમાણમાં આંશિક ઘટાડો

અમદાવાદ, તા.૧૫
રાજ્યમાં અનેક શહેરોમાં તાપમાનનો પારો ગગડતા નાગરિકોને કાળજાળ ગરમીથી આંશિક રાહત મળી છે, ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં હજુ ગરમીનું જોર ઘટવાની આગાહી કરી છે. આગામી ૪૮ કલાક બાદ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આગામી પાંચ દિવસ તાપમાન ૪૦ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. હાલમાં રાજ્યમાં પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશાના પવન ફુંકાઈ રહ્યા છે જેના કારણે બપોરના સમયે લૂનો અનુભવ થઈ રહ્યો છે. આજે અમદાવાદ અને રાજકોટમાં સૌથી વધુ ૪૧.૭ ડિગ્રી ગરમી નોંધાઈ હતી. અમરેલીમાં

બજેટની બાબતોને ઝડપથી અમલમાં મૂકવા અને પેટ્રોલ-ડિઝલમાં દૈનિક મોનિટરીંગ કરવા મુખ્યમંત્રીએ આપ્યા કડક આદેશ

ગાંધીનગર, તા.૧૫
આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યમંત્રી મંડળની એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અને ચર્ચાએ વિવિધ મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સરકારે રાજ્યના વિકાસ કાર્યો અને પ્રજાલક્ષી યોજનાઓને વધુ ગતિશીલ બનાવવા માટે કેટલાંક મહત્વના નિર્ણયો લીધા છે. મંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે રાજ્યના વિકાસ કાર્યો અને પ્રજાલક્ષી યોજનાઓને વધુ ગતિશીલ બનાવવા માટે કેટલાંક મહત્વના નિર્ણયો લીધા છે. મંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે રાજ્યના વિકાસ કાર્યો અને પ્રજાલક્ષી યોજનાઓને વધુ ગતિશીલ બનાવવા માટે કેટલાંક મહત્વના નિર્ણયો લીધા છે. મંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે રાજ્યના વિકાસ કાર્યો અને પ્રજાલક્ષી યોજનાઓને વધુ ગતિશીલ બનાવવા માટે કેટલાંક મહત્વના નિર્ણયો લીધા છે.



મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યમાં ઉપલબ્ધ પેટ્રોલ અને ડિઝલના જથ્થાની સમીક્ષા કરી મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે કે, રાજ્યમાં દરરોજ કંટ્રોલ રૂમ દ્વારા પેટ્રોલ-ડિઝલના જથ્થાનું મોનિટરીંગ કરવામાં આવે અને જરૂરિયાત મુજબ તેની સપ્લાય વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે જેથી નાગરિકોને મુશ્કેલી ન પડે.

શૈક્ષણિક વર્ષ શરૂ થાય, ત્યારે રાજ્યનો કોઈપણ લાયક વિદ્યાર્થી તેને મળવાપાત્ર શિષ્યવૃત્તિથી વંચિત ન રહે તેની ખાસ તકેદારી રાખવા અને સતત દેખરેખ રાખવા માટે પણ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યમંત્રી મંડળની મહત્વની બેઠક મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યમાં ઉપલબ્ધ પેટ્રોલ અને ડિઝલના જથ્થાની સમીક્ષા કરી મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે કે, રાજ્યમાં દરરોજ કંટ્રોલ રૂમ દ્વારા પેટ્રોલ-ડિઝલના જથ્થાનું મોનિટરીંગ કરવામાં આવે અને જરૂરિયાત મુજબ તેની સપ્લાય વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે જેથી નાગરિકોને મુશ્કેલી ન પડે.

આજથી અમદાવાદના વસ્ત્રાપુર હાટમાં યોજાશે 'કેસર કેરી મહોત્સવ'

ગાંધીનગર, તા.૧૫
અમદાવાદ અને ગાંધીનગરના નગરનજી માટે ઉનાળાની આકરી ગરમીમાં મીઠાકાશ ભળવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ વિભાગ હસ્તકના ગુજરાત એગ્રો દ્વારા ખેડૂતોને તેમના ઉત્પાદનનો પોષણક્ષમ ભાવ મળે અને શહેરીજનોને શુદ્ધ, રસાયણમુક્ત ફળો મળે તેવા આશય સાથે અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે 'કેસર કેરી મહોત્સવ-૨૦૨૬'નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવનો આત્મીકાલે તા. ૧૬ મે, ૨૦૨૬ના રોજ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી વચ્ચે અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે 'કેસર કેરી મહોત્સવ-૨૦૨૬'નું આયોજન કરવામાં આવ્યું છે.

મહોત્સવ અંતર્ગત આગામી તા. ૧૫ જૂન સુધી કેરીનું તથા તા. ૧૬થી ૨૫ જૂન દરમિયાન જીઆઈ ટેગ ખારેકનું વેચાણ થશે. કેસર કેરી મહોત્સવ-૨૦૨૬માં ઉભા કરાયેલા આશરે ૧૦૦ જેટલા સ્ટોલ પૈકી ૮૫ સ્ટોલ કેરી માટે અને ૧૫ સ્ટોલ જીઆઈ ટેગ ખારેક માટે તૈયાર કરીને વિવિધ ખેડૂત મંડળીઓ, નેચરલ ફાર્મિંગ એકેડેમીઓ તેમજ કેરી અને

ખારેકનું ઉત્પાદન કરતી વ્યક્તિગત ખેડૂતોને વિના મૂલ્યે ફાળવવામાં આવ્યા છે. આ મહોત્સવ માત્ર ખરીદીનો પોઈન્ટ જે નહીં, શહેરી ગ્રાહકો અને ગ્રામ્ય ઉત્પાદકો વચ્ચે સીધા સંવાદ અને વિશ્વાસનું માધ્યમ બનશે. આ મહોત્સવની મુલાકાત લઈ નગરજનો સીધા કેરી પકવતા ખેડૂતો પાસેથી તાજા અને કાર્બોઈડ ફી કેરી ખરીદી શકશે.

રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજથી તા.૩૦ દરમિયાન

૭થી ૧૫ વર્ષના બાળકો માટે 'સમર યોગ કેમ્પ'

ગાંધીનગર, તા.૧૫
ઉનાળાની રજાઓ મનોરંજનની સાથે સાથે બાળકોના શારીરિક, માનસિક અને સાંસ્કૃતિક વિકાસ માટે પણ એક ઉત્તમ બની શકે છે. આજના સમયમાં બાળકોમાં વધતો મોબાઇલનો ઉપયોગ, શારીરિક તણાવ અને અનિયમિત જીવનશૈલીને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 'સમર યોગ કેમ્પ-૨૦૨૬'નું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૬ની ઉજવણી અને યોગના વ્યાપક પ્રચાર-પ્રસારના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં ૭થી ૧૫ વર્ષના બાળકો માટે વિશેષ સમર યોગ કેમ્પ યોજાશે. અને અભ્યાસ પ્રત્યે ધ્યાન વધે તે માટે આ અનોખું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આગામી તા. ૧૬ મે ૨૦૨૬થી તા. ૩૦ મે ૨૦૨૬ દરમિયાન સમગ્ર રાજ્યના વિવિધ શહેરો, તાલુકાઓ અને ગામોમાં અંદાજિત ૨૨૫ જેટલા 'સમર યોગ કેમ્પ'નું આયોજન કરવામાં આવશે. રાજ્યના અનેક વિસ્તારોમાં સમર યોગ કેમ્પનું આયોજન કરીને બાળકો યોગ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે.

સઈજ જીઆઈડીસી ખાતેની દુર્ઘટના

ટાંકી સાફ કરવા ઉતરેલા ત્રણના ઝેરી ગેસ ગળતરના લીધે મોત

કલોલ, તા.૧૫
કલોલના સઈજ જીઆઈડીસી વિસ્તારમાં ગત રાત્રે દુર્ઘટના ઘટી હતી. મફતલાલ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં આવેલા ઈટીપી પ્લાન્ટની અંદરગ્રાઉન્ડ ટાંકી સાફ કરવા ઉતરેલા ત્રણ પરમાતિય શ્રમિકોના ઝેરી ગેસ ગળતરને કારણે ગૂંગળામણને કારણે મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય એક શ્રમિક ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જણવા મળતી માહિતી મુજબ કલોલના સઈજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી 'મફતલાલ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ લિ.'ની યુનિટ સી/૧૫થી ૧૮માં તાપગતીના કાપડ પર કલર કામ કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન નીકળતા રંગીન પાણીના શુદ્ધિકરણ માટે એક આરસીસીની અંડર ગ્રાઉન્ડ ટાંકી બનાવવામાં આવી હતી. આ ટાંકીની સાફકામગીરી કામગીરી ગત તા. ૧૪ની રાત્રિના આશરે સાડા નવ વાગ્યાની આસપાસ હાથ ધરવામાં આવી હતી. શ્રમિકો દ્વારા ટાંકીમાંથી મોટર પંપ વડે પાણી કાઢવા બાદ તળિયે દોઢ ફુટ જેટલો જમા થયેલો કચરો અને કાદવ દૂર કરવા માટે શ્રમિકો પ્લાસ્ટિકના કેરબા અને લોખંડીની સીડીના સહારે એક પછી એક ટાંકીમાં ઉતર્યા હતા. સૌ પ્રથમ અમિત પરીહાર અને અરકુમાર શ્રીવાસ્તવ ટાંકીમાં ઉતર્યા હતા. અને ગળતરને કારણે ગૂંગળામણને કારણે બેભાન થઈ કાદવમાં ફસાયા હતા. પોતાના મિત્રોને બચાવવા માટે અનિલ લોધી પણ અંદર ઉતર્યા હતા. પરંતુ તે પણ ગૂંગળામણનો શિકાર બન્યો અને બેભાન થઈ ત્યાં ઢળી પડ્યો હતો. અંતે આ ત્રણેયને બચાવવાના પ્રયાસમાં શિવનાથ દુબેએ પણ ટાંકીમાં ઝંપલાવ્યું હતું જો કે, તેઓ ઓક્સિજનની અછતને કારણે તે પણ સાથે જ ફસાઈ ગયો હતો. આમ, સાથીદારોને બચાવવાની મથામણમાં શ્રમિકો કાળનો કોળિયો બન્યા હતા. આમ અમિત (ઉ.વ.૩૩, ઉત્તર પ્રદેશ) અને શિવનાથ દુબે (ઉ.વ.૪૪, ઉત્તર પ્રદેશ)ના મોત નીપજ્યા હતા. જ્યારે અનિલ લોધી સારવાર હેઠળ છે.

હાઈવે પર રાત્રે આડેધડ વાહનો પાર્ક કરવા મુદ્દે હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

ટ્રક સાથે બાઈકના અકસ્માત કેસમાં ટ્રક ડ્રાઈવર સંપૂર્ણપણે જવાબદાર

અમદાવાદ, તા.૧૫
ગુજરાત હાઈકોર્ટ એક મહત્વપૂર્ણ ચુકાદામાં રાત્રે હાઈવે પર આડે રસ્તે સૂચકો કે પાર્કિંગ હાઈવે વિના પાર્ક થયેલી ટ્રક સાથે બાઈકના અકસ્માતના કેસમાં ટ્રક ડ્રાઈવરને સંપૂર્ણપણે જવાબદાર ઠરાવ્યો છે. હાઈકોર્ટે પ્રસ્તુત કેસમાં બાઈકચાલકને દોષી ઠેરવવાની વાતને ફગાવી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે, બાઈકર સૂચકો કે પાર્કિંગ હાઈવે વિના પાર્ક થયેલો જો શેર અને તરત જ રોકેલો તેવી અપેક્ષા રાખવી ગેરવાજબી છે. વધુમાં, હાઈકોર્ટે આ કેસમાં મુત્તમના આગ્રહિતોનું વળતર રા.પાંચ લાખથી વધારી રૂ.૧.૮ લાખનું કરી આપ્યું હતું. હાઈકોર્ટે સાથે સાથે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, મોટર વાહન અધિનિયમની જોગવાઈઓ મુજબ, ચેતવણી વિના હાઈસ્પીડ લેવા પર કોમર્શિયલ વાહનોને બેદરકારીપૂર્વક પાર્ક કરવા એ મોટી જવાબદારીનો ગુનો છે. હાઈકોર્ટે જણાવ્યું કે, રેકર્ડ પરના પુરાવા પરથી સ્પષ્ટ થાય છે કે, અકસ્માત સમયે ટ્રક એવી રીતે પાર્ક કરવામાં આવી હતી કે તેનો અડધો ભાગ રસ્તા પર હતો અને બાકીનો અડધો ભાગ રસ્તાની બાજુમાં હતો, જેમાં કોઈ સૂચક, પાર્કિંગ સિગ્નલ અથવા અવરોધ મુકવામાં આવ્યા ન હતા. જેથી વાહનોને સાવચેત કરી શકાય અને અકસ્માત ટાળી શકાય. આમ, કોઈ સૂચક, રિકલેક્ટર અથવા ચેતવણી સિગ્નલના અભાવે, મુત્તક માટે રસ્તા પર પાર્ક કરેલા ટ્રકને જોવું હાઈવે પર અડધા રસ્તા પર કોઈપણ પ્રકારની ચેતવણી સિગ્નલ, રિકલેક્ટર અથવા પાર્કિંગ હાઈવે વિના ઉભેલી ટ્રકની પાછળ અથડાયા હતા, જેમાં માથામાં ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું કરૂણ ત નીપજ્યું હતું. દરમિયાન આ હુકમની નારાજ થઈ મુત્તકના આગ્રહિત પત્ની તરફથી કરાયેલી અપીલમાં હાઈકોર્ટનું ધ્યાન દોરાયું હતું કે પ્રસ્તુત કેસમાં સમગ્ર અકસ્માત માટે ટ્રક ડ્રાઈવરની જ સંપૂર્ણપણે જવાબદારી ઠરે છે. હાઈકોર્ટે જણાવ્યું કે, રાત્રે હાઈવે પર જોખમી સંકેતો અને સૂચકો વિના આ પ્રકારે ગેરકાયદે વાહનો પાર્ક કરવાની બાબતમાં વાહન માલિકની જવાબદારી માને છે. હાઈવે પર આવા ગેરકાયદેસર પાર્કિંગ આ પ્રકારના ગમખાવર અકસ્માતોનું મુખ્ય કારણ છે. આવા સંજોગોમાં નાના વાહનોની ઝડપની દલીલ અસ્થાયી છે. રાત્રિના સમયે હાઈવે ટુ વ્હીલરના વાહનચાલકો માટે સ્થિર વાહનોને જોવું મુશ્કેલ છે અને તેના કારણે ટ્રક ડ્રાઈવર જ આવા જોખમ માટે સંપૂર્ણપણે જવાબદાર ઠરે છે. કોમર્શિયલ ભારે વાહનોએ હાઈવે પર પાર્ક કરતી વખતે સલામી પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ.

વરસાદી પાણીના નિકાલ માટે રૂ.૧૦૮ કરોડના ૪૯ કામોનું આયોજન

અમદાવાદ, તા.૧૫
અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીના ઝડપી નિકાલ અને વોટર પ્રોજેક્ટ વિભાગમાં કુલ ૧૯ લોગિંગની સમસ્યા ઘટાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટોર્મ વોટર વિભાગ અંતર્ગત વિવિધ ઝોનમાં સઘન પ્રિ-કામો પૂર્ણ થયા કરોડના ૪૯ કામોનું આયોજન કરાયું છે. તેમાં સૌથી વધુ કામગીરી ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા હાથ ધરાઈ છે. ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગમાં કુલ ૧૯ કામો રૂ. ૮.૭૫ કરોડના ખર્ચે હાથ ધરાયા છે, જેમાંથી ૬ કામો રૂ. ૧.૧૨ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યા છે જ્યારે ૧૩ કામો રૂ. ૭.૬૩ કરોડના ખર્ચે હાલમાં ચાલુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા દરમિયાન વરસાદી પાણીના ઝડપી નિકાલ અને વોટર પ્રોજેક્ટ વિભાગમાં કુલ ૧૯ કામો રૂ. ૮.૭૫ કરોડના ખર્ચે હાથ ધરાયા છે, જેમાંથી ૬ કામો રૂ. ૧.૧૨ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યા છે જ્યારે ૧૩ કામો રૂ. ૭.૬૩ કરોડના ખર્ચે હાલમાં ચાલુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા દરમિયાન વરસાદી પાણીના ઝડપી નિકાલ અને વોટર પ્રોજેક્ટ વિભાગમાં કુલ ૧૯ કામો રૂ. ૮.૭૫ કરોડના ખર્ચે હાથ ધરાયા છે, જેમાંથી ૬ કામો રૂ. ૧.૧૨ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યા છે જ્યારે ૧૩ કામો રૂ. ૭.૬૩ કરોડના ખર્ચે હાલમાં ચાલુ છે.

એમકે દાસ (છેલ્લા પાનાનું ચાલુ)

ધોલેરાના વિકાસને એક નીવ ઊંચાઈ પર લઈ જશે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના પરિણામે મુસાફરીના સમયમાં ધરખમ ઘટાડો થશે, જેમાં સાબરમતીથી ધોલેરા એરપોર્ટ સુધીનું અંતર માત્ર ૪૮ મિનિટમાં અને સરખેજથી ધોલેરા એરપોર્ટ સુધીનો સમય માત્ર ૩૮ મિનિટમાં કાપી શકાશે. આ આધુનિક રેલ પ્રોજેક્ટની પાસિયત એ છે કે, તેમાં ઐતિહાસિક અને પ્રવાસી મહત્વ ધરાવતા લોથલને પણ કનેક્ટ કરવામાં આવ્યું છે. જે સાંસ્કૃતિક વારસાને વેગ આપશે. મુખ્ય સચિવએ વધુ વિગતો આપતા કહ્યું કે, આ પ્રોજેક્ટ ધોલેરા સ્માર્ટ સિટીના સર્વાંગી વિકાસ માટે ગેમ-ચેન્જર સાબિત થશે. આ મલ્ટિમોડલ કનેક્ટિવિટીના પરિણામે માત્ર મુસાફરોની અવરજવર જ સરળ નહીં બને, પરંતુ ઉદ્યોગો વ્યાપારને પણ મોટો વેગ મળશે. જેનાથી ધોલેરા ગ્લોબલ હબ તરીકે ઉભરી આવશે. ભવિષ્યમાં જેમ જરૂર જણાવે તેમ વધુ વિકાસ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. 'પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ દુરંદર્શી નેતૃત્વ હેઠળ મજૂર થયેલો આ પ્રોજેક્ટ ગુજરાતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસમાં નવો અધ્યાય સાબિત થશે.

DEEP INDUSTRIES LIMITED

CIN: L14292GJ2006PLC049371
Registered Address: 12A & 14, Abhishree Corporate Park, Ambli Bopal Road, Ambli, Ahmedabad - 380 058.
Ph. +91 98256 00533, +91 99090 09898 • E-mail: cs@deepindustries.com • Website: www.deepindustries.com

EXTRACTS OF AUDITED STANDALONE & CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON 31st MARCH, 2026

The Full format of the financial results for the quarter and year ended 31st March 2026 are available on the Stock Exchange website (www.bseindia.com and www.nseindia.com) and on the Company's website (www.deepindustries.com).
The same can be accessed by scanning the QR code provided below.

On behalf of the Board of Directors
Paras Shantilal Savla
Chairman & Managing Director
DIN:00145639